



### બ્રેમ્પટનમાં વિક્ટોરિયા ડે 2022

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (મે 17, 2022) – આ વર્ષે, વિક્ટોરિયા ડે સોમવાર, મે 23 નાં રોજ આવશે.

સમુદાયને સહાયરૂપ થવા અગ્નિશમન અને કટોકટીની સેવાઓ, ટ્રાફિક સેવાઓ, કાયદાકીય અમલ બજવાણી, રોડ ઓપરેશન્સ અને સુરક્ષા સેવાઓ સહિતની તમામ અનિવાર્ય અને નિર્ણાયક સેવાઓનું રાખેતા મુજબનું સંચાલન ચાલુ રહેશે.

રહેવાસીઓ કોઈ પૂછપરછો માટે 311 અથવા 905.874.2000 (બ્રેમ્પટન બહારથી) નંબર પર ફોન કોલ કરી શકે છે, Brampton 311 એપનો ઉપયોગ કરી શકે છે (App Store અથવા Google Play પર ઉપલબ્ધ) અથવા વેબસાઇટ [www.311brampton.ca](http://www.311brampton.ca) પર ઈમેઇલ સરનામું [311@brampton.ca](mailto:311@brampton.ca) પર ઈમેઇલ મોકલી શકે છે. અમે સીટી ઓફ બ્રેમ્પટન કે રીજીયન ઓફ પીલને સંબંધિત કોઈપણ બાબતો માટે 24/7 ઉપલબ્ધ છીએ.

#### આતશબાજી સુરક્ષા

વિક્ટોરિયા ડે વર્ષમાં ચાર મંજૂર કરેલા દિવસોમાંથી એક છે જ્યારે બ્રેમ્પટનમાં પરમીટ લેવાની જરૂરિયાત વગર ખાનગી મિલકત પર ટૂંકા-અંતરના ફટાકડાઓ ફોડવાની છૂટ આપવામાં આવે છે. બાય-લો (પેટા-કાનૂન) હેઠળ, આતશબાજીની પરવાનગી કેનેડા ડે, દિવાળી અને નૂતન વર્ષની પૂર્વ સંધ્યાએ પણ આપવામાં આવે છે.

ટૂંકા-અંતરના ફટાકડાઓ એ હોય છે જે ત્રણ મીટર (10 ફૂટ) કરતા ઓછું અંતર કાપતા હોય જ્યારે તે છોડવામાં આવે (દા.ત. ફાઉન્ટેઇન્સ, વીલ્સ, ગ્રાઉન્ડ સ્પિનર્સ, સ્પાર્કલર્સ). જે અંદાજે બ્રેમ્પટન ટ્રાન્ઝિટ બસ કે બાસ્કેટ બોલના હૂપ જેટલી ઊંચાઈ હોય છે.

રોકેટ જેવા અન્ય તમામ ફટાકડાં ફોડવાની બ્રેમ્પટનમાં મનાઈ છે. સીટી રહેવાસીઓને યાદ અપાવે છે કે ફટાકડાઓ સ્ટ્રીટ, સાઇડવૉક્સ પર, શહેરના પાર્ક્સ કે મ્યુનિસિપલ અથવા સ્કૂલ મિલકતોમાં ફોડવાની પરવાનગી નથી.

ખાનગી મિલકત પર ટૂંકા-અંતરના ફટાકડાઓ ઉપયોગમાં લેતી વખતે, રહેવાસીઓએ નીચેની સુરક્ષા સાવચેતીઓ અચૂક અનુસરવી રહી:

- ફટાકડાં હોલવવા પાણી ભરેલું પાત્ર અથવા પાણી ભરેલી હોઝ લાઇન પોતાની પાસે ઉપલબ્ધ રાખો.
- તમારા હાથમાં સ્પાર્કલર સિવાય કોઈ ફટાકડા ક્યારેય ફોડશો નહિ કે પકડી રાખશો નહીં.
- ફટાકડાં અન્ય લોકો પર ક્યારેય ફેંકશો નહિ કે ચિંધશો નહીં.
- સ્પાર્કલર્સનો ઉપયોગ કર્યા પછી, તેનો નિકાલ કરતા પહેલાં તેને પૂરેપૂરા ઠંડા પાડવા પાણીના પાત્રમાં રાખો.
- બધાં ફટાકડાનો નિકાલ કરતા પહેલાં તેને પૂરેપૂરા ઠંડા થવા દો.

દર વર્ષે, ફટાકડા વિક્રેતાઓ ફટાકડા વેચવાનું લાઇસન્સ મેળવે ત્યાર પહેલાં તેઓએ સીટીની તાલીમ લેવી અનિવાર્ય છે. સીટીએ વિક્રેતાઓને ઓનલાઇન તાલીમ આપવાની તૈયારી બતાવી. વિક્ટોરિયા ડે માટે નવા ફાયરવર્ક્સ લાઇસન્સીસ આપવામાં આવ્યા નથી. જો સ્ટોર્સમાં કે



બ્રેમ્પટનમાં બીજે ક્યાંય ફટાકડા વેચાતા હોવાનું રહેવાસીઓના ધ્યાનમાં આવે તો, તેઓને 311 અથવા 905.874.2000 (બ્રેમ્પટન બહારથી) નંબર પર કોલ કરીને સર્વિસ બ્રેમ્પટનને જાણાવવાનું કહેવામાં આવે છે.

ફટાકડાથી સુરક્ષા અને બાય-લોઝ (પેટા-કાનૂનો) વિશે વધુ માહિતી મેળવવા વેબસાઈટ જુઓ, [www.brampton.ca/fireworks](http://www.brampton.ca/fireworks).

### બ્રેમ્પટન ટ્રાન્ઝિટ

બ્રેમ્પટન ટ્રાન્ઝિટ વિક્ટોરિયા ડે માટે રવિવાર/રજાના દિવસના સમયપત્રક પ્રમાણે ચાલુ રહેશે. ટર્મિનલ્સ પર ગ્રાહક સેવા કાઉન્ટર્સ બંધ કરવામાં આવ્યા છે. સંપર્ક કેન્દ્ર ઉતારુઓને સહાયરૂપ થવા સવારે 7 થી સાંજે 9 વાગ્યા સુધી ઉપલબ્ધ છે.

બ્રેમ્પટન ટ્રાન્ઝિટની બધી બસોમાં અને બ્રેમ્પટન ટ્રાન્ઝિટ ટર્મિનલ્સમાં [પ્રોવિન્સના નિયમનો](#) અનુસાર મારક્સ પહેરવાનું ચાલુ રહેશે. બસ સેનિટાઈઝિંગ અમલમાં રહે છે, અને સગવડો અને ટર્મિનલ્સ જેની સપાટીઓ સખત હોય તે રોજિંદા ધોરણે સાફ કરીને સેનિટાઈઝ કરવામાં આવે છે.

સર્વિસ અઘતન માહિતી માટે વેબસાઈટ [www.bramptontransit.com](http://www.bramptontransit.com) જુઓ અથવા [@bramptontransit](https://twitter.com/bramptontransit) ને Twitter પર અનુસરો. કોઈ પ્રશ્નો સીધા બ્રેમ્પટન ટ્રાન્ઝિટના સંપર્ક કેન્દ્રને 905.874.2999 નંબર પર પૂછી શકાય છે.

### બ્રેમ્પટન પાર્ક્સ

વિક્ટોરિયા ડે પર, બ્રેમ્પટનમાં લીશ-ફી ડોગ પાર્ક્સ સહિત, બધી મનોરંજનલક્ષી ટ્રેઈલ્સ (પગદંડીઓ), પ્લેગ્રાઉન્ડ્સ, અને પાર્ક્સ ખુલ્લા રહે છે. દરેક વ્યક્તિના આરોગ્ય અને સુખાકારી માટે શારીરિક પ્રવૃત્તિ મહત્વની હોય છે! આપણાં પાર્ક્સ અને રિક્રિએશનલ ટ્રેઈલ્સ શોધવા વેબસાઈટ [www.brampton.ca/parks](http://www.brampton.ca/parks) જુઓ.

### બ્રેમ્પટન રિક્રિએશન

બ્રેમ્પટન રિક્રિએશન સેન્ટર્સ વિક્ટોરિયા ડે પર સંચાલનના સુધારેલા કલાકો પ્રમાણે ખુલ્લા રહેશે. રજાના દિવસોના કલાકો [અહીં](#) જોઈ શકાય છે. શહેરભરમાં ફેલાયેલા સ્પેશ પેંડ્સ શનિવાર, મે 21 નાં રોજ અત્યારની ઋતુ માટે ફરીથી ખુલવા નિર્ધારિત છે, જો હવામાન અનુકૂળ રહે. સ્પેશ પેંડ્સના સ્થળો, કલાકો, અને સંચાલન સ્થિતિની અઘતન માહિતી [અહીં](#) જુઓ.

વેબસાઈટ [www.brampton.ca/recreation](http://www.brampton.ca/recreation) જોઈને રિક્રિએશન સેન્ટર્સ, ઉપલબ્ધ કાર્યક્રમો, સભ્યપદો અને વધુ માહિતી મેળવો.

### બ્રેમ્પટન લાઈબ્રેરી

વિક્ટોરિયા ડે પર રવિવાર, મે 22 અને સોમવાર, મે 23 નાં રોજ બ્રેમ્પટન લાઈબ્રેરીની તમામ શાખાઓ બંધ રહેશે.

અમારી સાથે વેબસાઈટ [www.bramptonlibrary.ca](http://www.bramptonlibrary.ca) પર ઓનલાઈન જોડાઈને ઈ-બુક્સ અને ઓડિયોબુક્સ, સ્ટ્રીમ ટેલીવિઝન અને મૂવીસ ઉઘીની લો, વિવિધ શ્રેણીના શૈક્ષણિક, રચનાત્મક, અને વ્યાવસાયિક ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ્સ, અને ઘણી વસ્તુઓ સુધી પહોંચ મેળવો.



અમારા [આયોજનોના કેલેન્ડર](#) મારફતે બધી ઉમરના લોકો અને હિતો માટે વર્ચ્યુઅલ, બ્રાંચમાં અને ડ્રોપ-ઇન કાર્યક્રમો માટે નોંધણી કરાવો અને ઈમેઈલથી અમારી અદ્યતન માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો. અમને [Facebook](#), [Twitter](#), [Instagram](#), અને [LinkedIn](#), પર અનુસરો અને iOS અને ગૂગલ પ્લે પર બ્રેમ્પટન લાઈબ્રેરી મોબાઈલ એપ યોક્કસ ડાઉનલોડ કરો. [અમારી એપ વિશે વધુ વિગતો માટે અહીં ક્લિક કરો.](#) અમારા કર્મચારીઓ સાથે લાઈવ ચેટ કરવા, કોઈ પ્રશ્ન પૂછવા, અમારી વેબસાઈટ જુઓ.

### બ્રેમ્પટન એનિમલ સર્વિસીસ

બ્રેમ્પટન એનિમલ શેલ્ટર વિક્ટોરિયા ડે નિમિત્તે બંધ રહેશે. એનિમલ કંટ્રોલ (પ્રાણી નિયંત્રણ) સોમવારથી શુક્રવાર સવારે 7 થી રાત્રે 10 વાગ્યા સુધી અને શનિવારે અને રવિવારે અને રજાઓના દિવસોમાં સવારે 8 થી સાંજે 6:30 વાગ્યા સુધી રોડ પર હોય છે. આ સિવાયના સમયે, એનિમલ કંટ્રોલ માત્ર ઈમરજન્સીમાં પ્રતિભાવ આપશે.

### વિક્ટોરિયા ડે વીકએન્ડ માટે પીલ પબ્લિક હેલ્થના રિમાઈન્ડર્સ

આપણાં સમુદાયમાં COVID-19 ફેલાવાનું ચાલુ છે ત્યારે, વાઈરસ સામે જાહેર આરોગ્ય ઉપાયો આપણાં શ્રેષ્ઠ બચાવમાં રહે તે યાદ રાખવું મહત્વનું છે. COVID-19 નો ફેલાવો રોકવા કોઈપણ વસ્તુ પોતાની મેળે 100 ટકા અસરકારક નથી પણ જાહેર આરોગ્ય ઉપાયોના સ્તરો શ્રેષ્ઠ સંરક્ષણ પૂરું પાડે છે. સંરક્ષણના સ્તરોમાં સામેલ છે:

- રસીકરણ કરાવવું.
- બીમાર હોઈએ ત્યારે ઘરે રહેવું.
- તમારા હાથ વારંવાર ધોતા રહેવું.
- ખાંસી અને છીંક ઢાંકીને યોગ્ય શ્વસનલક્ષી શિષ્ટાચારનો મહાવરો કરવો.
- જરૂર પડે ત્યારે ઉચ્ચ-ગુણવત્તાના મારસ્કનો ઉપયોગ કરવો.

પીલમાં તમારી COVID-19 વેક્સિન મેળવવા બુકિંગ કેવી રીતે અને ક્યાં કરાવવું તે અંગે વધુ માહિતી માટે વેબસાઈટ [peelregion.ca/coronavirus/vaccine/](https://peelregion.ca/coronavirus/vaccine/) જુઓ. [ઓન્ટેરિયો સુરક્ષિતપણે રિઓપન કરવાના પ્લાન](#)માંની પ્રોવિન્સની માર્ગરેખાઓ અનુસરીને એકબીજાની સંભાળ લો.